

Date: 22nd June 2023

To,
The Manager,
Department of Corporate Services,
BSE Limited P. J. Towers, Dalal Street,
Fort, Mumbai - 400 001

Scrip code: 505358
ISIN: INE984B01023

Dear Sir/Madam,

Sub: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations, 2015") - Newspaper Advertisement

Pursuant to Regulation 30 of the Listing Regulations, 2015, we enclose herewith a copy of the notice published in English and vernacular language (Gujarati) newspapers on 22nd June 2023 in Business Standard, English Edition and Vadodara Samachar, Gujarati Edition informing the members inter alia about the Book Closure, dispatch of Annual Report for F.Y. 2022-23 and procedure for remote voting.

We request you to kindly take the same on record.

**Thanking you,
For Integra Engineering India Limited**

**Harneetkaur Anand
Company Secretary**



Integra Engineering India Limited

Registered Office & Works Unit - I : Post Box No. 55, Chandrapura Village, Tal. : Halol - 389 350. Dist. Panchmahals, Gujarat, India
Phone: +91-2676-221870, 90999 18471, Fax: +91-2676-220887

Works Unit - II : Halol-Champaner Road, P.O. Chandrapura, Tal. : Halol - 391 520. Dist. Panchmahals, Gujarat, India Phone: +91-99240 9926
www.integraengineering.in E-mail : info@integraengineering.in CIN : L29199GJ1981PLC028741

APPENDIX IV [rule-8(1)]
POSSESSION NOTICE (for immovable property)
 (as per Appendix IV read with Rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002)

EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED
 Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098

Whereas, The Authorized Officer of the Secured Creditor mentioned herein, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

Thereafter, Assignor mentioned herein, has assigned the financial assets to **Edelweiss Asset Reconstruction Company Limited** also as its acting in its capacity as trustee of **Various Trust** (hereinafter referred as "EARC") vide Assignment Agreement dated. Pursuant to the assignment agreement, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees, pledges have vested in **EARC** in respect of the financial assistance availed by the Borrower and **EARC** exercises all its rights as the secured creditor.

The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the borrower(s) and the public in general that the undersigned being the Authorized Officer of **Edelweiss Asset Reconstruction Company Limited** has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for below mentioned amount and interest thereon.

Name of Assignor	Name of Trust	Loan A/c Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
Bajaj Housing Finance Limited	EARC TRUST SC 422	428DLF0102 969258 & 428DLF0102 969286	(1.) Mr. Rajat Jain (Borrower), (2.) Mrs. Jyoti Jain (Co-Borrower)	Rs. 60,90,836/- (Rupees Sixty Lacs Ninety Thousand Eight Hundred Thirty Six Only) as on 14-07-2021 & 22-07-2021	19-06-2023	Physical Possession
L & T Housing Finance Ltd.	EARC TRUST SC 396	SRTHL17000365	(1.) Mr. Paresih Vithalbhai Nagpure (Borrower), (2.) Mrs. Chhayaben Pareshbhai Nagpure (Co-Borrower)	Rs. 21,17,54,56/- (Rupees Twenty One Lacs Seventeen Thousand Seven Hundred Fifty Four And Fifty Six Paise Only) as on 05-05-2022 & 17-05-2022	18-06-2023	Physical Possession

Description of Secured Asset - Schedule Property: All that piece and parcel of the immovable property bearing Shop No. 7, Super Built Up Area Measuring 582 Sq. Foot., Built Up Area Measuring 35.68 Sq. Mtrs Carpet Area Measuring 29.73 Sq. Mtrs., Along with undivided share in the land of Road & Cop in "Polaris", Situated at Revenue Survey No. 610/12, Revenue Block No. 1464 of Moje Village: Dihen, Ta: Olpad, City: Surat, Gujarat. **Bounded as Under:** East By: Society Road, West By: Plot No. 75, North By: Plot No. 73, South By: Society Road.

Property-1: All that piece and parcel of the immovable property bearing G-Type Plot No. 74 admeasuring 63.94 sq.mtrs., Along with 29.44 sq.mtrs. undivided in the Road & 10.39 sq.mtrs. undivided share in the COP, In "LOTUS VALLEY RESIDENCY", Situated at Revenue Survey/Block No. 996, Survey No. 691/1 Admeasuring 0 Hecor A.82 Are 96 sq.mtrs. i.e. 8296 sq.mtrs., Khata No. 334, Akar RS. 8.44/- Paisa of Moje Village: Dihen, Ta: Olpad, City: Surat, Gujarat. **Bounded as under:** East by: Society Road, West by: Plot No. 75, North by: Plot No. 73, South by: Society Road.

Property-2: All that piece and parcel of the immovable property bearing F-Type Plot No. 75 admeasuring 65.87 sq.mtrs., Along with 31.71 sq.mtrs. undivided in the Road & 10.7 sq.mtrs. undivided share in the COP, In "LOTUS VALLEY RESIDENCY", Situated at Revenue Survey/Block No. 996, Survey No. 691/1 Admeasuring 0 Hecor 82 Are 96 sq.mtrs. i.e. 8296 sq.mtrs., Khata No. 334, Akar RS. 8.44/- Paisa of Moje Village: Dihen, Ta: Olpad, City: Surat, Gujarat. **Bounded as under:** East by: Plot No. 74, West by: Society Road, North by: Plot No. 76, South by: Society Road.

Property-3: All that piece and parcel of the immovable property bearing F-Type Plot No. 76 admeasuring 68.87 sq.mtrs., Along with 31.71 sq.mtrs. undivided in the Road & 11.19 sq.mtrs. undivided share in the COP, In "LOTUS VALLEY RESIDENCY", situated at Revenue Survey/Block No. 996, Survey No. 691/1 Admeasuring 0 Hecor 82 Are 96 sq.mtrs. i.e. 8296 sq.mtrs., Khata No. 334, Akar RS. 8.44/- Paisa of Moje Village: Dihen, Ta: Olpad, City: Surat, Gujarat. **Bounded as under:** East by: Plot No. 73, West by: Society Road, North by: Plot No. 77, South by: Plot No. 75.

Property-4: All that piece and parcel of the immovable property bearing A-Type Plot No. 77 admeasuring 65.87 sq.mtrs., Along with 31.71 sq.mtrs. undivided in the Road & 11.19 sq.mtrs. undivided share in the COP, In "LOTUS VALLEY RESIDENCY", situated at Revenue Survey/Block No. 996, Survey No. 691/1 Admeasuring 0 Hecor 82 Are 96 sq.mtrs. i.e. 8296 sq.mtrs., Khata No. 334, Akar RS. 8.44/- Paisa of Moje Village: Dihen, Ta: Olpad, City: Surat, Gujarat. **Bounded as under:** East by: Plot No. 72, West by: Society Road, North by: Plot No. 78, South by: Plot No. 76.

Place: Gujarat
 Date: 22.06.2023

Authorized Officer
 Edelweiss Asset Reconstruction Company Limited

DEBTS RECOVERY TRIBUNAL-I
 (Ministry of Finance, Government of India)
 2nd Floor, Bhikubhai Chambers, Nr. Kocharab Ashram, Ashram Road, Paldi, Ahmedabad-380006.

Established u/s. 3 of the Recovery of Debts due to Banks & Financial Institutions Act, 1993 for the area comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan, Sabarkantha (Himmatnagar), Banaskantha (Palanpur) of Gujarat State w.e.f. 1st June, 2007.

O.W. No. 405/2023 O.A. No. 365/2022 Exh. No. 09

STATE BANK OF INDIAAPPLICANT
M/S. MAA ARBUDA FOOD PRODUCT & ORS.DEFENDANT

PUBLIC SUMMONS

To,
 (1) M/S. MAARBUDA FOOD PRODUCT (PROPRIETOR FIRM), Plot No. AB/305, GIDC, Dahegam, Dist. Gandhinagar.
 (2) MR. JIGAR UMESHBHAI PRAJAPATI (PROPRIETOR), 60, Luhar Chakra, Dehgam, Dist. Gandhinagar.

1. Whereas the above named Applicant / Appellant has filed the above referred application / appeal in this Tribunal.
 2. Whereas the service of Summons could not be effected in the ordinary manner and whereas the application for substituted service has been allowed by this Tribunal.
 3. You are directed to appear before this Tribunal in person or through an Advocate and file Written Statement / Say on **14.07.2023 at 10.30 A.M.** and show cause as to why reliefs prayed for should not be granted.
 4. Take notice that, in default of, the Application / Appeal shall be heard and decided in your absence.

Given under my hand & seal of this
 Tribunal on this 24.04.2023 at Ahmedabad

(Rakesh Kesar) Registrar
 DRT-1, Ahmedabad

Asset Recovery Department, BOI Building, Sector-16, Gandhinagar-382016. Ph. 9023722939

NOTICE FOR PUBLIC AUCTION OF PLEDGED GOLD JEWELLERY/ORNAMENTS/COINS

It is hereby brought to the notice of the following gold loan borrower, their legal heirs, persons engaged in business of gold Jewellery/Ornaments/Coins and general public that in spite of repeated reminders/ notices by the Bank, the following borrowers are not repaying their dues to the Bank.

Notice is hereby published that if they fail to deposit all their dues in their respective gold loan accounts (including up-to-date interest and all costs charges/expenses) by **06.07.2023**, then from **11:00 am of 07.07.2023** their Pledged Gold Jewellery /Ornaments/Coins will be put for Public Auction in the Bank of India, Ujda Branch Premises For this, Bank shall not be held responsible for any inconvenience or damage caused to the concerned borrowers and no allegations or representations will be entertained from any borrowers in this regard.

Persons interested to take part in the bidding should deposit Rs. 500/- (Rupees Five Hundred Only) with the Branch Manager before the scheduled time/date towards earnest money. Persons having taken part in final bidding must be able to deposit full amount to the Bank within 48 hours, failing which their earnest money, deposited with the Bank will be forfeited. Bank reserves the right to cancel the auction without assigning any reasons in case, the bidding price so arrived at, is observed to be low or inadequate. Further, if need be, Bank reserves the right to change the date, time or place of the above scheduled auction or cancel the same without assigning any reasons thereon.

A/c. Number	Branch & Contact No.	Borrower Name	Address	Floor Price	Gross Weight of the Gold
2212776 10000389	Ujha 7017053076	Snehaj Jigarkumar Desai	At and PO Amudh, Dist. Mehsana	6,13,493/-	172.82 Grams
2212776 10000410	Ujha 7017053076	Snehaj Jigarkumar Desai	At and PO Amudh, Dist. Mehsana	2,19,313/-	40.35 Grams

ZONAL MANAGER, GANDHINAGAR

INTEGRA ENGINEERING INDIA LIMITED
 ENGINEERING (CIN : L29199GJ1981PLC028741)

Registered Office : Post Box No. 55, Chandrapura Village, Tal. Halol - 389350, Dist. Panchmahals, Gujarat.
 Ph. No.: 02676 - 221870, 9099918471. Email ID: info@integraengineering.in Website: www.integraengineering.in

NOTICE FOR 41st ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

1. NOTICE is hereby given pursuant to Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014 that 41st Annual General Meeting (AGM) of the Shareholders of **Integra Engineering India Limited** will be held on **Wednesday, 19th July 2023 at 03:00 P.M. IST** through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) in compliance with General Circular numbers 14/2020, 17/2020, 20/2020, 02/2021, 02/2022 issued on 8th April, 2020, 13th April, 2020, 5th May 2020, 13th January 2021, 5th May 2022, respectively and circular no. 10/2022 dated 28th December 2022 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI) to transact the business as contained in the notice of the meeting.

2. In compliance with the above circulars, electronic copies of the Notice of the 40th AGM and Annual Report 2022-23 have been sent to all the shareholders whose email addresses are registered with the Bank / Depository Participant(s) on 16th June 2023. A copy of the same is available on Company's website i.e. www.integraengineering.in and on website of e-voting Agency i.e. www.evotingindia.com.

3. Shareholders holding shares either in physical form or dematerialized form, as on the cut-off date i.e. 12th July 2023 may cast their votes electronically on the business as set forth in the Notice of 41st AGM through the electronic voting system of CDSL.

Shareholders are hereby further informed that:

- The business as set forth in the Notice of the 41st AGM will be transacted through remote e-voting and e-voting system at the 41st AGM;
- The Register of the Shareholders and Share Transfer Register of the Bank will remain closed from Thursday, 13th July 2023 to Wednesday, 19th July 2023 (both days inclusive) for the purpose of 41st Annual General Meeting.
- The remote e-voting shall commence at 9:00 a.m. IST on Sunday, 16th July 2023 and end at 5:00 p.m. on Tuesday, 18th July 2023;
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the 41st AGM shall be 12th July 2023;
- Remote e-voting module will be disabled after 5:00 p.m. IST on 18th July 2023;
- Any person, who acquires shares of the Company and becomes a member post-dispatch of the Notice of the 41st AGM and holds shares as on the e-voting cut-off, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com (e-voting agency's email address). However, if a person is already registered with CDSL, for e-voting, then the existing user ID and password can be used for casting their vote;
- Shareholders may note that:
 - The facility for e-voting will also be made available during the 41st AGM, and those shareholders present in the 41st AGM through VC / OAVM, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the 41st AGM;
 - The Shareholders members who have cast their votes by remote e-voting prior to the 41st AGM may also attend the 41st AGM but shall not be entitled to cast their votes again; and
 - Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the 41st AGM.
- The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses is provided in the Notice of the 41st AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.integraengineering.in to obtain such details.
- Shareholders who have not registered their email addresses are requested to register their email addresses with respective depository participant(s) and members holding shares in physical mode are requested to update their email addresses with Company's Registrar and Share Transfer Agent, LINK INTIME INDIA PVT. LTD, at https://linkintime.co.in/EmailReg/Email_Register.html and to receive copies of the Annual Report 2022-23 along with the Notice of the 41st AGM, instructions for remote e-voting and instructions for participation in the 41st AGM through VC / OAVM please refer Company's website at www.integraengineering.in or contact Registrar and Share Transfer Agent.
- If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Rakesh Dalvi at toll free number 1800 22 55 33.

4. The aggregate results of Remote E-voting and voting at the AGM will be announced within 2 days of the 41st AGM by the Company on its website and also informed to the Stock Exchanges.

5. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) section of www.evotingindia.com or contact to Mr. Rakesh Dalvi, Sr. Manager (CDSL), A Wing, 25th Floor, Marathon Futurex, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai- 400013 at toll free number 1800 22 55 33, Email id:- helpdesk.evoting@cdslindia.com. Members may also write to the undersigned at the above mentioned address or email at harnetkaur.anand@integraengineering.in.

For Integra Engineering India Limited
 Sd/-
 Harnetkaur Anand
 Company Secretary

Date : 21.06.2023
 Place : Halol

पावरग्रिड POWERGRID

NOTICE

1. Approval under Regulation-86 of CERC (Conduct of Business) Regulations'1999 and CERC (Terms and Conditions of Tariff) Regulations' 2019 for determination of Transmission Tariff from Actual/Anticipated DOCO to 31-03-2024 for Asset-I: Bus splitting through Series Reactor (Incl. Series Reactor) & other associated works and reorientation of Transmission lines near Wardha substation under "Scheme to Control fault level at Wardha Substation".

2. The beneficiaries of the above mentioned Transmission system are: (a) Madhya Pradesh Power Management Company Ltd. (b) Electricity Department, Administration of Daman & Diu, Daman, (c) Gujarat Uja Vikas Nigam Ltd., Vadodara. (d) Electricity Department, Government of Goa, Panaji, (e) Maharashtra State Electricity Distribution Company Ltd., Mumbai, (f) Madhya Pradesh Aduyogik Kendra Vikas Nigam (Indore) Ltd, Indore, (g) Maharashtra State Electricity Transmission Co. Ltd, (h) Chhattisgarh State Power Distribution Co. Ltd, (i) DNH Power Distribution Corporation Limited.

3. Tariff details:

Name of the Asset	Asset-1
Schedule DOCO (FR)	19.10.2019
DOCO (Actual/Anticipated)	25.11.2022
Estimated Completion Cost (Rs in Lakhs)	6122.44
Tariff for 2019-24 Tariff Block (Rs in Lakhs)	
2022-23	303.40
2023-24	989.76

4. A copy of the application made for determination of tariff is posted on the website of the applicant at www.powergrid.in

5. The suggestions and objections, if any, on the proposals for determination of tariff contained in the application be filed by any person, including the beneficiary before the Secretary, Central Electricity Regulatory Commission, 3 & 4th Floor, Chandrakil Building, Jangpeth, New Delhi - 110 001 (or other address where the office of the Commission is situated), with a copy to the applicant at the address of its corporate office within 30 days of publication of this notice.

Sd/-
 GM (Commercial)

Place: GURUGRAM
 Date: 19.06.2023

POWER GRID CORPORATION OF INDIA LIMITED
 (A Government of India Enterprise)
 Reg. Office: B-9, Qutab Institutional Area, Katwaria Sarai, New Delhi-110 016.
 Corp. Office: "Saudamini", Plot No. 2, Sector-29, Gunnam-120001, (Haryana)
www.powergrid.in, CIN : L40101DL1989GOI038121

A Maharatna PSU

BEFORE THE HON'BLE II LABOUR COURT AT CHENNAI C.P.NO.12 of 2023

R. Annamalai
 S/o Rangasami
 No.44, II Floor, Vivekananda Street, Sakthi Nagar, Kumaran Nagar Extension, Padi, Chennai-600050
 ...Petitioner

Versus

M/s Mishtann Foods Limited
 Branch Office
 D.No 351, Madhavaram Red hills Road, Grand Lyon (Line) Opp. Essar Petrol Pump, Chennai, Tamil Nadu-600052
 Head Office
 C-808, Ganesh Maridian, Opp. Gujarat High Court, S.G.Highway, Ahmedabad-380060
 ...Opposite Party

To
 M/s Mishtann Foods Limited
 Head Office
 C-808, Ganesh Maridian, Opp. Gujarat High Court, S.G.Highway, Ahmedabad-380060

That the above Claim Petition had been filed by the petitioner against the opposite party to pay a sum of Rs. 1,22,41,91/- (Rupees One Lakh Twenty-Two Thousand Four Hundred and Nineteen Only) towards the salary outstanding for the month of June, 2019 to till 22nd September, 2019 and in which the Hon'ble court had ordered notice to you on 19.05.2023 and returnable by 28.06.2023. Kindly appear on the said date either in person or through your pleader as otherwise the matter will be heard in your absence.

Counsel for Petitioner
 K. Thyagarajan

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC09792

Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031.
 Tel : +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) (the loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr. No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	55118758	Home Loan	1. Arun Bhimrao Shinde 2. Ranjana Arun Shinde	26.04.2023	INR 10,07,824.79/-	All That Piece And Parcel Of Property Bearing B-type, Plot No. 11 (as Per 7/12 New Block No. 491-11 Admeasuring 40.18 Sq. Mtrs.), As Per Site Admeasuring 44.61 Sq. Mtrs., Along With 27.52 Sq. Mtrs. Undivided Share In The Land Of Road & Cop, In "dream Villa", Situate At Revenue Survey No. 357, Old Block No. 439 Paiki New Block No. 491 Of Moje Village Haldharu, Ta: Kamrej, District: Surat, Gujarat-394310, And Bounded As: East : Adj. Plot No. B/10, West : Adj. Plot No. B/12, North : Adj. Society Road, South: Adj. Block No. 438

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
 Authorized Officer
 IDFC First Bank Limited
 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)

Date : 22.06.2023
 Place : Surat

IDFC FIRST Bank

Rapicut Carbides Limited

Regd. office : 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat
 Tele : 7622002203/ 7573022016 CIN : L28910GJ1977PLC002998
 Email : investors@rapicutcarbides.com Website : www.rapicutcarbides.com

NOTICE TO SHAREHOLDERS

TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)
 Provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Rule 6 of Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and amendments made thereto, inter-alia provide for transfer of all shares in respect of which dividend has not been claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund set up by the Central Government. The Company has communicated to concerned shareholders whose shares are liable to be transferred to IEPF, at their latest available address and uploaded details of such shareholders i.e. Name and their Folio No. / DP ID / Client ID on its website at www.rapicutcarbides.com/finance.htm. Shareholders may access the website to verify details of the shares liable to be transferred to IEPF.

Shareholders concerned may make an application to the Company/Registrar by 30th September, 2023 with a request for claiming the unpaid dividend for the year 2015-16 onwards so that shares would continue to be registered in their names. If no reply is received by 30th September, 2023, the Company will transfer the shares to the IEPF without any further notice by following due process as under:

- In case of shares held in demat mode : by transfer of shares directly to demat account of IEPF Authority with the help of Depository Participants.
- In case of shares held in physical form : by issuing new share certificates and thereafter transferring the same to IEPF authority and in such cases original share certificates of these shareholders shall stand cancelled and will not exist.

Shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed from the IEPF Authority by filing Web Based Form IEPF-5 as prescribed under the said Rules.

For any query shareholders are requested to contact Secretarial Department of the Company Tel: 07622002203/7573022016, Email ID: investors@rapicutcarbides.com or Company's Registrar and Transfer Agents at M/s Link Intime India Pvt Ltd, Tel : 022 49186270, Email ID : rnt.helpdesk@linkintime.co.in/iepf.shares@linkintime.co.in

For Rapicut Carbides Limited
 Komal Soni
 Company Secretary

Date : 22/06/2023
 Place : Ankleshwar

HERO HOUSING FINANCE LIMITED

Contact Address: Shop no-309, Third Floor, Nishal Center, Near Nishal Circle, Pal, Surat, Gujarat-395007.
 Regd. Office: 05, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057.
 Ph: 011 49267000, Toll Free No: 1800 212 8800, Email: customer.care@herohf.com
 Website: www.herohousingfinance.com | CIN: U65192DL2016PLC30148

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES)
 (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice as mentioned below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs etc. from date mentioned below.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Loan Account No.	Name of Obligor(s) Legal Representative(s)	Date of Demand Notice/ Amount as per Demand Notice	Date of Possession (Constructive / Physical)
HFFSRHQH 1900006330 & HFFSRJPL 1900006343	Mr. Rajbharat Sakaldeep Yadao, Mr. Yadao Rajbharat Sakaldeep, Mrs. Yadao Parvati Devi Rajbharat	03/12/2021, Rs. 13,60,452/- as on date 03/12/2021	21/06/2023 (Physical Possession)

Description of Secured Assets/Immovable Properties: All that piece and parcels of Residential Plot/Land bearing Plot No. 4 admeasuring 57.33 sq. yard, As Per Passing Plan admeasuring 48.01 sq. mts., Along with 27.20 sq. mts. undivided share in the land of Road & COP, Total admeasuring 75.21 sq. mts., in "Mahak Residency", Situate at Revenue Survey No. 421, 422, 411, 402, 393, 394, Block No. 42, 43 & 44 admeasuring 22156 sq. mts., of Moje Village Madhar, Ta: Olpad, Sayan Bhrandri, Dist: Surat, Gujarat-394130. With Common Amenities Written in Title Document. Property Bounded By: North: Adj. Madhar Kareli Road, East: Adj. Plot No. 5, West: Adj. Plot No. 3, South: Society Road.

DATE :- 22-06-2023, PLACE:- SURAT

Sd/- Authorized Officer
 FOR HERO HOUSING FINANCE LIMITED

NEW INDIA CO-OPERATIVE BANK LTD.
 (Multistate Scheduled Bank)

Corporate Office : New India Bhawan, A.V. Nagwekar Marg, Prabhadevi, Mumbai - 400025.

NOTICE UNDER SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 AND RULE 8 (6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002

NI/CO/RC/207/2023-2024 Date: 21.06.2023.

To,
 1. M/s. Flock Creation Pvt. Ltd. ----- Borrower
 H. No. 1401-2-3, Plot-1, 4th Floor, Hari Nagar H. Society, Nanpura, Surat-395 001.
 2. Mr. Kirtikummar Otamchand Doshi ----- Director/Surety
 3. Mr. Yash Kirtibhai Doshi ----- Director/Surety
 4. Mrs. Pragana Kirtikummar Doshi ----- Surety
 201-202, Amizara Apartment, Kailash Nagar Sagrapurra, Surat-395 002.
 5. Mr. Harmil Jatinbhai Shah ----- Surety
 404, Amizara Apartment, near Tennis Club Athwaines, Surat-395 001.

Dear Sir/Madam,
 Please take notice that the Residential Flat No.201 & 202, 2nd Floor, Earth Apartment, Shree Niranjani Apartment Co-operative Housing Society Ltd., Ward No. 2, Nondh No. 1956-A, Above Raymonds Showroom, Opp. Shakheshwar Complex, Sagrapurra, Surat-395 002 owned by Mr. Kirtibhai O. Doshi and Mrs. Pragana K. Doshi respectively which is mortgaged in favor of New India Co-op. Bank Ltd., Ring Road, Surat shall be sold by public auction to be held at New India Co-operative Bank Ltd., Annapurna Market, Kamela Darwaja, Ring Road, Surat - 395 003 for recovery aggregating of Rs.79,23,051.34 (Rs.14,28,497.81 under TL & Rs.64,94,553.53 under Cash Credit) together with future interest thereon @11.50% & 10% p.a. respectively compounded with monthly rest from 01.04.2021 onwards and costs, expenses and charges being the secured debt due and payable to New India Co-operative Bank Ltd. The Reserve Price of the said Flats have been fixed at Rs.72,18,000/- (Rupees Seventy Two Lakh Eighteen Thousand Only)

The property shall be sold under provisions of SARFAESI Act, 2002 after 15 days from the date hereof. The date and time fixed for public auction for sale of the said property shall be announced by publishing notice in two leading newspapers, in the area where the said property is located.

DISCRPTION OF THE PROPERTY BEING SOLD

Flat No.201 & 202, 2nd Floor, Earth Apartment, Shree Niranjani Apartment Co-Operative Housing Society Ltd., Ward No. 2, Nondh No. 1956-A, above Raymonds Showroom, Opp. Shakheshwar Complex, Sagrapurra, Surat-395 002 owned by Mr. Kirtibhai O. Doshi and Mrs. Pragana K. Doshi respectively.

Yours Truly,
 Sd/-
 (Bhaskara Amin)
 Asst. General Manager & Authorized Officer,
 New India Co-op. Bank Ltd.

NEW INDIA CO-OPERATIVE BANK LTD.
 (Multistate Scheduled Bank)

Corporate Office : New India Bhawan, A.V. Nagwekar Marg, Prabhadevi, Mumbai - 400025.

NOTICE UNDER SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 AND RULE 8 (6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002

NI/CO/RC/208/2023-2024 Date: 21.06.2023

To,
 1. M/s. Shree Rani Sati Creation, ----- Borrower
 Prop. Mr. Rajiv Kumar Purushottam Jalan
 Shop No. C-1266, Raghuukul Textile Market, Ring Road, Surat - 395 002.
 2. Mrs. Saloni Agarwal, ----- Surety
 Flat No. E/1101, Rushi Vihar Township, Parvat Patiya, Surat - 395 010.
 3. Mr. Nandkishore Hariram Saraf, ----- Surety
 90, Nemanthi Nagar, Nr. Model Town, Parvat Patiya, Surat - 395 010.

Dear Sir/Madam,
 Please take notice that the Residential Flat No.1101, 11th Floor, Rushi Vihar Township, Near Land Mark Market, Parvat, Surat which is mortgaged in favor of New India Co-op. Bank Ltd., Ring Road, Surat shall be sold by public auction to be held at New India Co-op. Bank Ltd., Annapurna Market, Kamela Darwaja, Ring Road, Surat - 395 003 for recovery of Rs.46,62,747.44 under Cash Credit together with future interest thereon @11.50% p.a. compounded with monthly rest from 01.04.2021 on wards and costs, expenses and charges being the secured debt due and payable to New India Co-op. Bank Ltd. The Reserve Price of the said Flats have been fixed at Rs.30,20,000/- (Rupees Thirty Lakh Twenty Thousand Only)

The property shall be sold under provisions of SARFAESI Act, 2002 after 30 days from the date hereof. The date and time fixed for public auction for sale of the said property shall be announced by publishing notice in two leading newspapers, in the area where the said property is located.

DISCRPTION OF THE PROPERTY BEING SOLD

Flat No. E/1101,

